

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને અર્થતંત્રને અને સામુદાયિક વિકાસને ગતિશીલ બનાવવાની યોજનાને

મંજૂરી આપી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 9, 2021) – આ અઠવાડિયે બ્રેમ્પટન સીટી કાઉન્સિલે પોતાની બેઠકમાં, રોજગાર વૃદ્ધિને ગતિશીલ બનાવવા, લક્ષ્યાંકિત ક્ષેત્રોમાં નવી ઈમારતના વિસ્તરણને સહાયરૂપ બનવા, અને બ્રેમ્પટનના સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા [સામુદાયિક સુધારણા યોજના \(કમ્યુનિટી ઇમ્પ્રુવમેન્ટ પ્લાન - CIP\)](#) ને મંજૂરી આપી.

વૈશ્વિક મહામારી શરૂ થઈ ત્યારથી, ધંધાકીય સમુદાયની રિકવરી અને સ્થિતિસ્થાપકતાને ટેકો આપવા સીટી કટિબદ્ધ રહ્યું છે.

ગયા વર્ષે, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે શહેરને આગળ ધપાવવાના માળખા તરીકે [આર્થિક રિકવરી વ્યૂહરચના](#)ને સમર્થન આપ્યું. આ વ્યૂહરચનાને ચાર પાયામાં ગોઠવવામાં આવી છે: *નવીન શોધ, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા*, જેમાં ધંધાકીય સાહસિકો અને નાના ધંધાઓ માટે વધારે સારી સહાયતાનો સમાવેશ થાય છે; *રોકાણ, કળા, સંસ્કૃતિ અને પર્યટન*; અને *માળખાગત સગવડ*.

આ શહેરે 2021 નાં Q1 માં બ્રેમ્પટનને મળેલી આયોજન અરજીઓ અને રોકાણો આકર્ષવાનું ચાલુ રાખ્યું છે અને તે વર્ષ 2020 અને 2019 નાં પ્રથમ ત્રણ મહિનાઓની સરખામણીમાં આવક લગભગ બમણી રહી છે.

CIP ની સ્થાપના તે ગતિને આગળ વધારવા, સ્થાનિક અર્થતંત્રને પુનઃગતિશીલ બનાવવા તરફ અને બ્રેમ્પટનના સ્પર્ધાત્મક લાભને આગળ વધારવા તરફ અન્ય એક પગલું છે. પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોનો પ્લાનિંગ એક્ટ (આયોજન અધિનિયમ) એક વિસ્તારને સામુદાયિક સુધારણા પ્રોજેક્ટ વિસ્તાર તરીકે નિમવાની સત્તા સ્થાનિક મ્યુનિસિપાલિટીઓને આપે છે જે પાનગી ક્ષેત્રને રોજગારની તકો અને વિકાસશીલ શહેર માટે જરૂરી સગવડો ઊભી કરવા દેવા નાણાકીય અને નાણાકીય-સિવાયના પ્રોત્સાહનો આપે છે.

CIP હેઠળ આપવાના સંભવિત સાધનોમાં, પ્રારંભિક પ્રોત્સાહન કર વૃદ્ધિ સમકક્ષ અનુદાન (ટેક્સ ઇન્ક્રિમેન્ટ ઇક્વિવેલેન્ટ ગ્રાન્ટ - TIEG) રહેશે જેનો હેતુ સંશોધન અને પ્રયોગશાળાની જગ્યા જેવા પૂરક ઉપયોગો સહિતની ઓફિસ નોકરીઓ આકર્ષવાનો છે. TIEG એક અનુદાન, અથવા છૂટ છે, જે ધંધાકીય માલિકે વેઠવા પડતા મિલકત વેરાના એક ભાગને બિનઅસરકારક બનાવે છે.

વધુમાં, ઓફિસ નોકરી માટે સમગ્ર શહેરને આવરી લેતા TIEG નું અમલીકરણ કરીને, સીટી ઓફ બ્રેમ્પટન 2021 માં શરૂ થવાની અપેક્ષા રખાતા પોતાના મોટા ઓફિસ પ્રોગ્રામ મારફતે અપાતી પ્રદેશની TIEG સુધી પહોંચ મેળવી શકશે. ગુણવત્તાસભર ઓફિસ જગ્યા માટે પ્રોજેક્ટ્સમાં રોકાણ વધારવાથી રહેવાસીઓ રહી શકે, કામ કરી શકે અને શીખી શકે તેવા “સંપૂર્ણ સમુદાયો”ના વાતાવરણને પણ પ્રોત્સાહન મળે છે.

સીટી કર્મચારીઓને 2021 નાં Q2 અને Q3 દરમિયાન CIP તૈયાર કરવાનો અને તેને અંતિમ રૂપ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સીટી આ વર્ષના અંતે કાયદેસર જાહેર બેઠક યોજશે અને અંતિમ CIP ઓન્ટેરિયો મિનિસ્ટ્રી ઓફ મ્યુનિસિપલ અફેર્સ એન્ડ હાઉસિંગને સમીક્ષા અને ટિપ્પણી માટે મોકલશે. Q4 નાં અંતે CIP શરૂ થાય તેવી અપેક્ષા છે.

CIP નિર્ધારિત સમયગાળા માટે આપવાની તૈયારી બતાવવામાં આવશે અને સીટી ઓફ બ્રેમ્પટનની રોજગારની જરૂરિયાતો સંતોષાતી હોવાના લક્ષ્યો અને હેતુઓની ખાતરી કરવા નિયમિતપણે તેની સમીક્ષા કરવામાં આવશે. CIP “[તકીથી ભરપૂર શહેર](#)” તરીકે કાઉન્સિલની અગ્રતાઓની શરત સાથે પણ અનુરૂપ છે.

CIP પોતાના ચાવીરૂપ ક્ષેત્રોમાં વધારાના રોજગારને આકર્ષવાનો હેતુ ધરાવે છે: નવીન શોધ અને ટેકનોલોજી; ઉદ્યોગસાહસિકતા; આરોગ્ય અને જીવન વિજ્ઞાન; અને અદ્યતન ઉત્પાદન. બ્રેમ્પટનમાં વર્તમાન બજારની સ્થિતિઓ આ ક્ષેત્રોમાંના દરેકમાં નવા બાંધકામમાં ચાલુ રોકાણને ટેકો આપે છે.

અવતરણો (ક્વોટ્સ)

“સામુદાયિક સુધારણા યોજના આપણી આર્થિક રિકવરીમાં ફાળો આપતા ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા સીટી ઓફ બ્રેમ્પટનની ક્ષમતાને વધારે તીવ્ર બનાવવા શ્રેણીબદ્ધ રીતો આપવાની તૈયારી બતાવે છે. બ્રેમ્પટન એક તકો આપતું શહેર છે અને આપણે વૈશ્વિક મહામારીમાંથી આર્થિક રિકવરી તરફ આગળ વધી રહ્યાં છીએ ત્યારે CIP સ્થાપિત કરવી એ આપણાં લક્ષ્યો સાકાર કરવા અન્ય એક મહત્વપૂર્ણ બાબત છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણી આર્થિક રિકવરી વ્યૂહરચના હેઠળ, કાઉન્સિલે સ્થાનિક ધંધાઓને ટેકો આપવા મહત્વની રોકાણ બાબતોમાંની એક તરીકે CIP ને ઓળખી છે. તેઓ આપણાં અર્થતંત્રનો મુખ્ય આધાર છે. બ્રેમ્પટનના ધંધાઓ સફળ થાય એટલે, આપણે સૌ વિજેતા બનીએ છીએ.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), વોર્ડ્સ 3 અને 4; રીજીયનલ કાઉન્સિલર અને પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ, પ્રમુખ, આર્થિક વિકાસ સમિતિ, સીટી ઓફ બ્રેમ્પટન

“આ સામુદાયિક સુધારણા યોજના આપણાં પાડોશોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તેમજ ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહિત કરશે અને આપણી પોતાની પ્રવૃત્તિઓ અને મહત્વની ભાગીદારીઓ મારફતે સમુદાયનો પુનરોદ્ધાર કરશે.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), વોર્ડ્સ 7 અને 8, રીજીયનલ કાઉન્સિલર અને ઉપ-પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટીનું 2040 વિઝન સમુદાયમાં રહેતા અને કામ કરતા સીટીના કર્મચારીઓની સંખ્યા વધારવાની જરૂરિયાતને ધ્યાનમાં લે છે. સામુદાયિક સુધારણા યોજના આપણાં સમુદાયમાં વધારે ઓફિસ રોકાણને આકર્ષાતી ઉચ્ચતર રોજગારને વધારે પ્રમાણમાં બ્રેમ્પટનને તબદીલ કરવામાં મદદરૂપ થશે.”

- પૉલ વિસેંટે (Paul Vicente), વોર્ડ્સ 1 અને 5, રીજીયનલ કાઉન્સિલર અને ઉપ-પ્રમુખ, પ્રમુખ - આર્થિક વિકાસ સમિતિ, સીટી ઓફ બ્રેમ્પટન

“સામુદાયિક સુધારણા યોજના પૂરી થાય ત્યારે તેમાં સીટી ઓફ બ્રેમ્પટન માટે રોજગાર નિર્માણ, કર આવક અને રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તામાં એકંદરે સુધારો સહિતના સ્થાયી લાભોને પ્રોત્સાહન આપવા, સંભવિત નાણાકીય-સિવાયના અને નાણાકીય કાર્યક્રમોના ‘ટૂલબોક્સ’નો સમાવેશ થશે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca